

## હે પ્રભુ ! હે પ્રભુ !

(દોહરા)

- હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ;  
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાણ. ૧
- શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ;  
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨
- નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંલી;  
આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાલી. ૩
- જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ;  
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪
- ‘હું પામર શું કરી શકું?’ એવો નથી વિવેક;  
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
- અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રકૃતિ ભાવ;  
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬
- અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ;  
કથા અલબ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭

ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન;  
 સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮  
 કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ;  
 તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯  
 સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ;  
 દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦  
 તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં;  
 નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાટિક માંહી. ૧૧  
 અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં;  
 નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨  
 એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય;  
 નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય? ૧૩  
 કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ;  
 પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪  
 અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન;  
 સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યુ નહિ અભિમાન. ૧૫

સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક;  
 પાર ન તેથી પામિયો, ઊંચો ન અંશ વિવેક. ૧૬  
 સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય;  
 સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭  
 પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય;  
 દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮  
 અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય;  
 એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯  
 પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ;  
 સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦

